

વર્ષ-૧૧, અંક-૨, સંવત ૨૦૭૧ ફાગણ સુદ-૬,
પ્રસિધ્ય તા. ૨૭-૦૨-૨૦૧૫, શુક્રવાર
છુટક નકલ રૂ. ૫-૦૦, વાર્ષિક લવાજમ રૂ. ૬૦-૦૦

Chetavni (GUJ) RNI No. GUJ GUJ / 2005 / 16095
Postal Regd. No. GAMC-1507/2015-2017 Valid up 31-Dec-2017
Posted at Ah'd PSO On 27th of Every Month

જ્યોતિર્માલા



વૈરાગ્યપૂતોના વચોડમૃતોના
પરિશ્રમે એણાતિસુગૂઢત્વમ् ।
સંદર્શ્ય ચેતો વિમલં વિદ્યાય
શ્રી વલ્લભેનાના મહો પ્રદીપ્તામ् ॥

અતિ પરિશ્રમ લઈ ગુહ્યતત્ત્વથી ભરપૂર અને આત્માને
ઉર્ધ્વગતિએ લઈ જનારા વૈરાગ્યમય ઉપદેશથી અમારા
આત્માની મલિનતા દૂર કરી (સદ્ગુરુ) શ્રી વલ્લભે જ્યોતિ
પ્રગાટાવી.

કલ્યાણિનાં શિષ્યગણાં વિદ્યાતું યદીચવાગ્છા સતતં સમાસ્તે ।
શિવસ્વરૂપઃ સતતં ચ આસ્તે રમૂજિલાલાય પ્રણામઅષઃ ॥

(જેમને શિષ્યોને કલ્યાણારૂપ બનાવવાની ઉલ્કટ તીવ્ર
ઈર્છા છે અને જેઓ સતત “શિવ સ્વરૂપ” છે તે (ગુરુદેવ)
રમુજુલાલને પ્રણામ હો.)

(ગતાંગથી ચાલુ...)

ધર્મ એવ હતો હન્તિ ધર્મો રક્ષતિ રક્ષિતઃ ।

(વ.વિ. ભાગ-૧)

જેણે ધર્મનો પરિત્યાગ કર્યો છે, તેનો ધર્મ નાશ કરે છે પણ જેણે ધર્મનું રક્ષણ (પાલન) કર્યું છે, તેનું ધર્મ અવશ્ય રક્ષણ કરે છે. અર્થાત્ જેણે ધર્મનું પાલન કર્યું છે, તેણે જ ધર્મનું રક્ષણ કર્યું છે અને જેણે ધર્મને હણ્યો છે તેજ હણાયો છે.

શ્રેયાન્સ્વધર્મો વિગુણઃ પરધર્માત્સ્વનુષ્ઠિતાત् ।

સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવહઃ ॥

(ભગવદ્ગીતા અ. ૩ શલો. ૩૫)

પરાયા વર્ણાશ્રમના ધર્મના કર્મ કરતાં પોતાના વર્ણાશ્રમના ધર્મના કર્મ કરવા તેજ હિતાવહ છે. સ્વધર્મમાં રહીને મરવું તે શ્રેષ્ઠ છે પણ પરાયા વર્ણાશ્રમના ધર્મનું કર્મ કરવું તે મહા ભય ભરેલું છે. અર્થાત્ દરેકને પોતાનો ધર્મજ કલ્યાણના માર્ગ લઈ જનાર છે, પરંતુ પરધર્મ એ અકલ્યાણમુક્ત તમામ પ્રકારે ભયથી ભરપુર છે.

હિંદુઓ એ હિંદુ ધર્મ, મુસ્લિમો એ મુસ્લિમધર્મ અને તેજ પ્રમાણે દરેક ધર્મવાળા એ પોતાનો ધર્મ કે જે ધર્મ પોતાના અસલના વડીલો પાળતા હતા તેજ મૂળ જાતિધર્મ દરેકે પાળવો જોઈએ અને પોતાના પુરાતની (પ્રાચીન) ધર્મમાં પુનઃ પ્રવેશ કરવો જોઈએ અને પાછળથી મનસ્વી રીતે ગ્રહણ કરેલા પરમધર્મનો પરિત્યાગ કરીને મૂળધર્મમાં પ્રવેશાય તોજ તે ધર્મથી તે મનુષ્યનું કલ્યાણ થાય, નહિ તો પરધર્મથી અકલ્યાણ થાય છે.

ધર્મેણ સુખં વિદેત ધર્મેણ પરિપાલયેત् ।
ધર્મમૂલાં શ્રિયં પ્રાપ્ય ન જહાતિ ન હીયતે ॥
શ્રીમર્ગલાત્પ્રભવતિ પ્રાગલભ્યાત્સંપ્રવર્ધતે ।
દાક્ષયાત્તુ કુરુતે મૂલં સંયમાત્પત્તિષ્ઠતિ ॥

(વ.વિ. ભાગ-૧)

ધર્મથી જ સુખ મળે છે. ધર્મથી જ સુખ સચવાય છે અને તેથી ધર્મના મૂળ સાધનરૂપ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે અને તે ધર્મ વડે પ્રાપ્ત થયેલી લક્ષ્મી ધર્માત્માનો ત્યાગ કરી શકતી નથી, પણ ધીમે ધીમે વૃદ્ધિ પામે છે. શુભ કર્માર્થથી લક્ષ્મી મળે છે,

ઉદારતા રાખવાથી વધે છે, ઈદ્રિયોને વશ રાખી પવિત્રતાથી ચાલવાથી નિશ્ચલ (અચલ યા સ્થિર) રહે છે અને દક્ષતાથી ધર્મકાર્યમાં વાપરવાથી મૂળ કરે છે.

ચાલુ જમાનામાં લક્ષ્મી પ્રાપ્ત થતાં અભિમાન, ઉદ્ઘતાઈ, સ્વચ્છંદતા, વિષયાશક્તિ અને પાપવૃત્તિઓ વધે છે. તેથી પાપ-વૃદ્ધિ થઈ પુણ્ય નષ્ટ થઈ, અત્યંત દુઃખ આવે છે. માટે સંસારનું અને લક્ષ્મીનું સુખ ભોગવવાનું સાધન “ધર્મપરાયણ વર્તન” છે.

ચલાલક્ષ્મીશ્વલા: પ્રાણશ્વલે જીવિતયૌવને ।

ચલાચલે ચ સંસારે બ્રહ્મ એકંહિ નિશ્ચલમ્ભ ॥

(વ.વિ. ભાગ-૧)

લક્ષ્મી નાશવંત છે, પ્રાણ નાશવંત છે, મનુષ્યનું જીવન નાશવંત છે અને યુવાની તથા સંસાર પણ નાશવંત છે, માટે નિશ્ચય છે કે આ સચરાચર સંસારમાં દરેક વસ્તુ નાશવંત છે. ફક્ત બ્રહ્મરૂપ પરમેશ્વર અને તેનો ધર્મ અચળ છે. માટે સર્વ પદાર્થોમાંથી તૃણાછોડી ધર્મનું સંપાદન કરવા સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ.

અનિત્યાનિ શરીરાણિ વિભવો નૈવ શાશ્વતઃ ।

નિત્યં સંનિહિતો મૃત્યુ: કર્તવ્યો ધર્મસંગ્રહઃ ॥

(વ.વિ. ભાગ-૧)

હે જીવાત્મા ! સંસારમાં પ્રાપ્ત થયેલા શરીરો નાશ પામવાના છે, વૈભવો કાયમરહેવાના નથી, થોડા સમયમાં ચાલ્યા જીવાના છે અને કાળ દરરોજ નજીક બ્રમણ કરી રહેલો છે, માટે સર્વ પ્રકાર વડે કરીને ધર્મનોજ સંગ્રહ કર. કેમકે જ્યારે સંસારના અનુભવ થાય છે ત્યારે જ તેની અસત્યતા સમજાય છે.

ન તુ કાશ્ચનયેત્ પ્રાજ્ઞો ગૃહીત્વૈવ કરૈન્રમ્ભ ।

ઉચ્યમાનસ્તુ ધર્મેણ સ્વયં લોકઃ પ્રવર્તતો ॥

(અનુશાન પર્વ)

ગમે તેવો જ્ઞાની પુરુષ પણ કોઈ માણસનો હાથ પકડી તેની પાસે પરાજો ધર્મ પળાવી શકે નાછિ. પરંતુ તેમણે કહેલા ધર્મમાર્ગમાં પ્રેમી લોકો પોતાની મેળે પ્રવર્તી શકે છે.

માટે આપણો આપણી મેળેજ ધર્મકર્મમાં આગળ વધવાનું છે. ગુરુ કે મહાન પુરુષો કોઈ આપણી પાસે આપણી ઈચ્છા સિવાય ધર્મકર્મ કરાવી શકનાર નથી અને જ્યાં સુધી

આપણે ધર્મ નહિ પાળીએ ત્યાં સુધી સદ્ગુપદેશ નિરર્થક જવા બરાબર છે, માટે આત્માનું અને ઉપદેશનું સાર્થક્ય કરવા માટે ધર્મ પર પરિપૂર્ણ પ્રીતિ રાખી પ્રભુના માર્ગમાં આગળ વધવું જોઈએ.

**શ્રુતિઃ સ્મૃતિઃ સદાચારઃ સ્વસ્ય ચ પ્રિયમાત્મનઃ ।
એતચ્યતુર્વિધં પ્રાહુઃ સાક્ષાદ્ર્મસ્ય લક્ષણમ् ॥**

(મનુસ્મૃતિ)

શ્રુતિ, સ્મૃતિ, સત્પુરુષોનું આચરણ અને જે વર્તન કરવાથી પોતાનો અંતરાત્મા સંતુષ્ટ રહે, તે ચારને ડાહ્યા પુરુષો ધર્મનું સાક્ષાત લક્ષણ કહે છે.

આહાર નિદ્રા ભય મૈથુનં ચ સામાન્યમેતત્ત પશુભિર્નરાણામ् ।

ધર્મો હિ તેષામાધકો વિશેષો ધર્મણા હીનઃ પશુભિસ્સમાનઃ ॥

ધર્માર્થકામણોક્ષાણાં યસ્યૈકોડપિ ન વિદ્યાતે ।

અજાગલસ્તનસ્યેવ તસ્ય જન્મનિરર્થકમ् ॥

મુહૂર્તમપિ જીવેચ્ય નરઃ કલેશેન કર્મણા ।

ન કલ્પમપિ કષ્ટેન લોકદ્વયવિરોધિના ॥

(વલ્લભ વિષી. ભાગ-૧)

(૧) ખાવું, ઊંઘવું, ભય, મૈથુન વિગેરે સંસારની તમામકિયા મનુષ્યમાં અને પશુમાં સરખીજ હોય છે. મનુષ્યમાં જો ધર્મ હોય તો જ તે પશુ કરતાં શ્રેષ્ઠ છે, નહિ તો ધર્મ રહિત મનુષ્ય પશુ સમાન છે. (૨) ધર્મ, અર્થ, કામઅને મોક્ષ, એ ચારે પુરુષાર્થો જેમણે મેળવ્યા નથી અર્થાત્ અર્થ અને કામતો મનુષ્ય માત્ર મેળવે છે પણ ધર્મ પ્રમાણે વર્તી મોક્ષ પ્રાપ્ત કરવો એ ધર્મ અને મોક્ષના બે પુરુષાર્થ જેઓ મેળવી શકતા નથી, જેમણે આ પુરુષાર્થો મેળવ્યા નથી તેમનો જન્મબકરીના ગણે નકામા આંચળ હોય છે તેવો નિરર્થક છે. (૩) ધર્મ પરાયણ સારા કર્મ કરીને થોડો વખત જીવાય તો પણ તે શ્રેષ્ઠ છે, પરંતુ આલોક અને પરલોકના વિરોધી દુર્જર્મ કરી એક કલ્પ (શાસ્ત્રોક્ત ગણતરી મુજબ બ્રહ્મના સમય પ્રમાણે) સુધી જીવવું તે નિરર્થક અને દુઃખરૂપ છે.

સારાં કર્મો વડે આત્મા પરમશાંતિ ભોગવે છે અને દુઃખરૂપ વડે અનહદ દુઃખો ભોગવે છે, માટે મનુષ્યના જીવતરમાંથી જેટલી ઘડીઓ અને જેટલા દિવસો પ્રભુભક્તિમાં, ગુરુભક્તિમાં અને આત્મકલ્યાણના માર્ગમાં વ્યતીત થયા, તે સમય

અને દિવસ સાફલ્યરૂપ સમજવા કે જે મનુષ્ય અવતારમાંથી ઉઠાવી આત્માને મોક્ષનો અધિકારી બનાવે છે.

ઈશાવાસ્યામિદ્દ સર્વ, યત્કિય જગત્યાં જગતઃ ।
તેન ત્યક્તેન ભુંજ્યથા, મા ગૃહઃ કસ્યશ્વિદ્ધનમ् ॥

(યજુર્વેદ)

હે જીવ ! આ જગતમાં, આખા વિશ્વમાં સર્વ સ્થળે પરમાત્માની અદ્ભુત શક્તિ વ્યાપક છે અને તે વડે પાપ, પુણ્ય ભોગવાય છે. માટે તે ઈશ્વરથી ડરીને તું વગર મહેનતે કોઈનું ધન મેળવવાની અન્યાયયુક્ત આકંક્ષા કર નહિ અને પોતાને જે મળે તેથી શાંતિ માની અન્યાય અને અનીતિના માર્ગનો ત્યાગ કરી ધર્મ-કર્મ વડે કરીને પોતાના આત્માનો અદ્ભુત આનંદ ભોગવ.

શ્રુત્વા ધર્મ વિજ્ઞાનાતિ શ્રુત્વા ત્યજતિ દુર્મિતિમ् ।
શ્રુત્વા જ્ઞાનમવાખોતિ શ્રુત્વા મોક્ષં ચ વિનદતિ ॥

શાસ્ત્રોના શ્રવણથી મનુષ્ય ધર્મ જાણે છે, દુર્મિતિને તજે છે, જ્ઞાનને મેળવે છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે.

પશો: પશુઃ કો ન કરોતિ ધર્મ
પ્રાધીતશોસ્તોપિનયાત્મબોધઃ ॥

(વ.વિ. ભાગ-૧)

પશુથી પણ પશુ કોણ ? કે જે મનુષ્ય ધર્મ પાળતો નથી તે, તથા શાસ્ત્રોને જાણ્યા છતાં જેને આત્મજ્ઞાન તથા પરમાત્મજ્ઞાન ન થયું હોય તે.

જીવસ્તં મૃતવન્મન્યે દેહિનં ધર્મવર્જિતમ् ।
મૃતોધર્મેણસંયુક્તો દીર્ଘજીવી ન સંશયઃ ॥

(વ.વિ. ભાગ-૧)

જેણે ધર્મ સંપાદન કર્યો નથી તેને જ્ઞાનવાન પુરુષો જીવતાં છતાં મરેલો માને છે, પરંતુ જે ધર્મપરાયણતામાં મરેલો છે તેને દીર્ଘકાળ પર્યત (સુધી) જીવતોજ માને છે. કારણ કે તેના ધર્મ-પરાયણ પ્રેમની કીર્તિ ગુરુશ્રીના હૃદયમાં ગુંજારવ કરી રહેલી હોય છે, માટે ધર્મપરાયણ વર્તનથી અને શુદ્ધ પ્રેમથી ગુરુની કૃપા મેળવી શકાય છે.

---૦---

શિષ્ય : ધર્મનો આધ્યાત્મિક અર્થ શું થાય છે, તે જણાવો.

ગુરુદેવ : આપણા આત્માના આત્મહદ્યમાં યા આત્મદહરમાં એક રૂપિયાની બે આની નિર્મળ તત્ત્વ રહેલું છે કે જેને આત્મજ્યોતિ કહેવામાં આવે છે. તે આત્મજ્યોતિને પરમજ્યોતિ પરમાત્મામાં વિલીન કરવી યા ભેળવી દેવી, તેને જ “પરમધર્મ” માન્યો છે.

મહારાજશ્રી વલ્લભરામે ધર્મ સંબંધી કહ્યું છે કે :-

છયો

મુસ્લિમકહેતા હૈ દીન, હિંદુ કહેતા હૈ ધર્મ;

કિશ્ચિઅન કહેતા હૈ રિલિઝયન, સબકા હૈ એકહી મર્મ.

સબકા હૈ એકહી મર્મ, સમજતે વિરલા કોક;

ઉલટ સુલટ સમજાતે, કવિ પંડિત લોક.

ધ્યા પ્રભુકા દેશ હૈ, ર્મભ્મા સંયોગરૂપ મર્મ;

આત્મજ્યોતિકા પ્રભુમે મિલન હુવે, “વ્યાસ” સચ્ચા એહી ધર્મ.

---૦---

ધર્મ બનાવે સંયમી, ધર્મ સહાસિક બનાવે;

ધર્મ બનાવે ધીર-વીર, ધર્મ જીતેદ્રિય બનાવે.

ધર્મ બનાવે અકોધી, ધર્મ સદાચારી બનાવે;

ધર્મ બનાવે નિયમયુક્ત, ધર્મ કર્તવ્યપરાયણ બનાવે.

મન ઈદ્રિયોને કાબુમાં રાખી, પ્રભુ ભણી લઈ જાય છે;

“વ્યાસ” સત્યે સત્ય કહે, તેને જ ધર્મ “ધર્મ” કહેવાય છે.

મહારાજશ્રી ધર્મની દીક્ષા આપી વખતે હંમેશા કહેતા કે :- “જીવનનું તત્ત્વ ધર્મ છે અને ધર્મનું તત્ત્વ મોક્ષ છે.”

અહીં યાદ રાખવું જોઈએ કે, જ્યાં સુધી ભારતવર્ષ પોતાની ગોદમાં પોઢેલા સંતોના જ્ઞાનતત્ત્વને સમજ્યા વિના પરદેશના સંતોને સમજવા દોટ મૂકૃતું રહેશે, ત્યાંસુધી “જીવનનું તત્ત્વ ધર્મ છે અને ધર્મનું તત્ત્વ મોક્ષ છે” તે ભુલાઈ જવાતાં પાશ્ચિમાત્ય સંસ્કારોથી જીવનનું તત્ત્વ ધન માની અને ધનનું તત્ત્વ સુખ માની મૃગજળ પાછળ દોડ્યા કરાશે તો નિરાશા અને સંકટો સિવાય કાંઈજ પ્રાપ્ત થનાર નથી.

લખચોરાશીમાંથી બાર લાખ યોનિ પસાર કર્યા બાદ પ્રભુ દ્યા કરી એક વાર મનુષ્ય અવતાર આપે છે. માટે તે મનુષ્ય અવતારમાં આત્મિક ધર્મનું કરોડો વિધો આવવા છીતાં રક્ષણ કરવું એજ મનુષ્યનું પરમધેય હોવું જોઈએ. આજ સત્ય સનાતન ધર્મની શીખ છે.

---૦---

૨૪

શિષ્ય : પરધર્મ નક્કે દેનાર અને સ્વધર્મ કલ્યાણ દેનાર છે, એમશા માટે કહેવામાં આવ્યું?

ગુરુદેવ : શ્રીકૃષ્ણપ્રભુએ ભગવદ્ગીતામાં અર્જુનને બોધ કર્યો છે કે :- ધર્મ સંસ્કારી મનુષ્યમાત્રે પરાયો મનુષ્ય પોતાનો ધર્મ કેવો પાળે છે અગર પાળતો નથી, તેનો વિચાર કર્યા વિના પોતે પોતાના સ્વધર્મનો જ વિચાર કરવો અને સ્વધર્મનુસાર પોતાની ફરજ અદા કરવી. સામો માણસ ગુણ ઉપર અવગુણ કરે તો પણ ધર્મનિષ્ઠ મનુષ્યે નિરંહકાર બુદ્ધિથી પોતાના કર્તવ્ય અને ધર્મ શું છે, તે વિચારી પોતાના ધર્મ અને કર્તવ્ય પ્રમાણે આચરણ કરવું તે જ કલ્યાણકર્તા છે. પરંતુ જો ધર્મનિષ્ઠ મનુષ્ય, દુનિયાના સ્વાર્થી અને સગવડપંથી મનુષ્યો જેવો વર્તાવ કરતા હોય અર્થાત્ પોતાની સામે બૂરો વર્તાવ કરતા હોય ત્યારે નીતિશાસ્ત્રો અનુસાર જેવા સામે તેવો થશે તો અર્થાત્ બુરા સામે બૂરો થશે તો સ્વધર્મનો લોપ થતાં, સ્વધર્મ તેનું કલ્યાણ કરશે નહિએ, એમજણાવ્યું છે.

ધાર્મિક માનવ કવચિત નીતિશાસ્ત્રનો અમલ કરવા જાય છે, પરંતુ કોઈક ક્ષણે તેનામાં દ્યા અને પ્રેમનો આવેશ તીવ્ર બને છે, ત્યારે તે આપોઆપ નીતિશાસ્ત્રનો અમલ છોડી દે છે. કેમકે, ધાર્મિકતામાં કઠોરતા અને નિર્દ્યતા નથી પણ દ્યાળુતા હોય છે, તેથી સ્વધર્મચિરરણીને પોતાનો ધર્મ પોતાના આત્માને સાદ આપે છે કે :- બીજા લોકો ભલે પોતાનો ધર્મ ચૂક્યા, ગુણ અને ઉપકાર ભૂલી ગયા, સ્નેહ અને ભમતા વિસારી દીધા, પરંતુ હે આત્મા ! તું તો પ્રભુનો છે, તારે પ્રભુના પંથે પળવાનું છે, તેથી તારો ધર્મ તું ન ચૂકીશ. જીવનમાં અગર મૃત્યુ સમયે તારા આત્માને પશ્ચાતાપ થાય કે :- અરેરે ! મારા સગાં, સંબંધી વા અન્યજનો પ્રત્યે મેં આટલુ કઠોર હદ્ય કર્યું અગર અમુક કર્તવ્ય ન બજાવ્યું, તેવો તને પશ્ચાતાપ થાય તેવું કોઈ પણ કૃત્ય કરીશ નહિએ. રાગદ્વેષ,

આસક્તિ, કોધ, મમતા અને બદલો લેવાની યા સામાના કર્તવ્યની સજા કરવાની અગર સામાને કર્તવ્યનું ફળ ચખાડવાની, જો તું ભાવના રાખીશ તો તારા સ્વર્ધમનું પાલન થશે નહિ અને પરધર્મના પાલનથી તારો આત્મા રડી-કકળી ઉઠશે અને આત્માનું હિત જોખમમાં આવશે.

આ રીતે અનેક પરિસ્થિતિનો વિચાર કરીને સંત મહાપુરુષોએ નિર્ણય કર્યો છે કે :- પરધર્મ પાલન એટલે અન્ય મનુષ્ય પોતાનો ધર્મ જે રીતે અદા કરતા હોય તે રીતે ધર્મનિષે આચરણ કરવું નહિ, પરંતુ નિસ્વાર્થ, નિર્માણ, નિર્લોભ અને નિષ્પક્ષ રહેલો આત્મા, પોતાને જે કર્તવ્ય કરવા આદેશ આપે તે કરવા સત્ય અને નીતિના માર્ગ રહીને પોતાનો ધર્મ જ પાલન કરવો. કેમકે પરધર્મ નક્કે દેનાર અને સ્વર્ધમ કલ્યાણ દેનાર છે.

આ સંબંધી અમુક ધર્મશાસ્કોએ માન્ય છે કે :- જેમતોઝાની ગાય સાથે શાણી અને સમજી ગાયને બાંધવામાં આવે તો તે તોઝાની બની જાય છે, તેમાન્યના કર્તવ્ય પ્રમાણે કરવા જનાર મનુષ્ય તેવાં કર્મો કરેલાં ન હોવાથી તેમજ તેવાં કર્માને કરવા ટેવાયેલો ન હોવાથી, પૂરેપૂરાં કઠોર કર્મો કરી શકતો નથી અને તે તેવાં કામોને અધવચ છોડી હેઠે. જેમઅર્જુન યુદ્ધ કરવા તૈયાર થયો, પરંતુ યુદ્ધક્ષેત્ર ઉપર જઈને હથિયાર છોડી બેઠો, તેમમાનવ સ્વભાવના મનુષ્યોની સામે ધાર્મિક મનુષ્ય, નીતિશાસ્કનો છેવટ સુધી અમલ કરી શકતો નથી અને કોઈક સમયે એકાએક દ્રવી (ગાંગાં બની) ઉઠે છે તેમજ નિર્મણ બની જાય છે. માટે ધાર્મિક મનુષ્યનો ધર્મ કોઈને સજા કરવા-કરાવવાનો નથી પણ ક્ષમા કરવાનો છે. ધર્મનિષે કર્તવ્યનિષે બનીને આસક્તિ કે માંગથી નહિ પણ અનાસક્તિ અને ત્યાગથી જવાબ આપવાનો છે.

---○---

૨૫

શિષ્ય : અમે સાંભળ્યું છે કે ધર્મ પાળનારમાં પણ બેદ છે અને બેદ હોય તો તે ક્યા ક્યા?

ગુરુદેવ : ધર્મ પાળનાર મનુષ્યોમાં પણ બે બેદ છે. એક મધ્યમઅને એક ઉત્તમ. તેમાં ઉત્તમના કરતાં મધ્યમવધારે શ્રેષ્ઠ છે.

ઉત્તમ અર્થાત્ જેઓ ઊંચ જન્મપ્રાપ્ત કરી શક્યા હોય તેઓ ઊંચ જન્મના ગુમાનમાં રહી સદ્ગર્મ પાળી કે ઉત્તમકર્મો કરી શકતા નથી. તેમજ ઉત્તમએટલે સાધુઓ,

સન્યાસીઓ, બ્રાહ્મણો, ઉપદેશકો, ગુરુઓ, કથાકારો, કીર્તનકારો, વેદાંતિઓ, શાસ્કીઓ, પુરાણીઓ તથા ભક્તો અન્ય જીવનોને સન્માર્ગે દોરતા હોય અને તેથી કરીને તેઓ ધર્મનેતા, દેશનેતા, જ્ઞાતિનેતા વિગેરે કહેવાતા હોય છે. તેઓના કરતાં શિષ્યવૃત્તિના દાસત્વ ભાવના અને મોટાઈ નહિ મેળવનાર લોકો કે જેને “મધ્યમ” કહેવામાં આવે તે શ્રેષ્ઠ છે. તેઓ કોઈ જ્ઞાનવાનનો સંગ થતાં પારસના સ્પર્શથી જેમ કથીર સુવર્ણ બને છે તેમ “મધ્યમ” જીવો જ્ઞાનયોગી થઈ શકે છે, અથવા તેમના થોડાધણા અંશો પ્રાપ્ત કરી શકે છે. પરંતુ જેમ પારસને લોખંડ સિવાયની અન્ય ધાતુઓ સ્પર્શ કરે તો તે સુવર્ણ બનતી નથી, કેમ કે તેનામાં ઊંચત્વનો ખ્યાલ અને અભિમાન હોય છે; તેમ ઉપર જણાવેલા “ઉત્તમ” લોકો સત્યજ્ઞાન, સત્ય ધર્મ-કર્મ અને યોગથી સદાએ વંચિત (વિમુખ) અને વિરક્ત (અનુરાગ કે સ્પૂષ્ટ વિનાના) રહે છે. જેણે શિક્ષકભાવના ધારણ કરેલ હોય તે મનુષ્ય શિષ્યભાવના ધારણ કરી શકતો નથી. “મધ્યમ” જીવો પોતાના ધર્મને ધારણ કરી રાખે છે અને “ઉત્તમ” તો પોતે ધર્મનો અવતાર હોવાનો મગજમાં ફાંકો રાખે છે એટલે તેઓ ધર્મની ગ્રહણશક્તિને ગુમાવી બેઠેલા હોય છે. કદાચ કોઈમાં ધર્મ હોય છે, પણ તે માત્ર વાચાળ શક્તિનો હોય છે. જીવનમાં ધર્મપરાયણતા ઉતારી હોય તો તેઓ કદી ધર્મવિરુદ્ધ પગ દેજ નહિ. પરંતુ તેમાં મોટો દોષ ભક્તો વગેરેને “મોટા બનાવનાર” અને “મધ્યમ” વર્ગનો છે. કેમકે તે એક સામાન્ય ભક્તને મહાન આત્માની ઉપમાઓ આપી તેના જીવનમાં જે જૂજ તત્ત્વ રહેલું હોય છે તે પણ બગાડી નાંખે છે. કીર્તિ વધ્યા પદ્ધી અને જગતમાં ઉત્તમઅને મહાન ગાણધ્યા પદ્ધી અહંકાર એટલો વધે છે કે :- પોતે પોતાના આત્માને, ઈશ્વરને તથા ગુરુ વિગેરે અન્યને ક્યાં અને કેટલો દગ્ગો કરી રહ્યો છે, તેનો તેને સ્વખ્ને પણ ખ્યાલ રહેતો નથી અને વ્યસનમાં લુબ્ધ બનેલો આત્મા બેભાનપણામાં ગમે તે કરે છે. અન્ય ઉપદેશ કરનારાઓ પણ મહાનુપણાના નશામાં ઘોર અપરાધો કરે છે. માટે સમજુ અને જ્ઞાની પુરુષો ઉત્તમતાનો જ ત્યાગ કરવા ઈચ્છે છે અને ‘દાસોસ્મિ’ ભાવનો સર્વદા સ્વીકાર કરી, મધ્યમ તરીકે રહી, ઉત્તમના ગુણો ગ્રહણ કરી ધર્મસેવા બજાવે છે.

(વધુ આવતાં અંકે)



ચૈત્ર સુદ પૂનમ ધર્મધજ મહોત્સવ અમદાવાદ

પ્રભુ-પરમાત્મા તથા સદ્ગુરુશ્રીઓની કૃપાથી સંવત ૨૦૭૧ના ચૈત્ર સુદ-પૂનમનો ધર્મધજ મહોત્સવ તા. ૦૪-૦૪-૨૦૧૫ને શાનિવારના મંગાલ દિને આવતો હોવાથી આ ધર્મધજ મહોત્સવ ઊંકારેશ્વર મંદિર, વલ્લભવાડી, અમદાવાદ મધ્યે આનંદપૂર્વક ઉજવવામાં આવશે. જેથી આ ઉત્સવ તથા પ્રયોગની પૂર્ણાંહૃતિમાં ભાગ લેનાર મુમુક્ષુઓએ તા. ૦૨-૦૪-૨૦૧૫ને ગુરુવારની સાંજ સુધીમાં અમદાવાદ આવી રહેલું.

પ્રયોગોની પૂર્ણાંહૃતિ બાબત

આગામી ધર્મધજ મહોત્સવના ઉત્સવ સાથે રેગ્યુલર પ્રયોગોની પૂર્ણાંહૃતિ તથા (૧) મહાવિભૂતિ પ્રેરણામૂર્તિ સદ્ગુરુશ્રી વલ્લભરામ ધ્યાન પ્રયોગની પૂર્ણાંહૃતિ (૨) મહાવિભૂતિ પ્રેરણામૂર્તિ સદ્ગુરુશ્રી રમુજુલાલ ધ્યાન પ્રયોગની પૂર્ણાંહૃતિ ઊંકારેશ્વર મંદિર અમદાવાદ મધ્યે આનંદપૂર્વક કરાવવામાં આવશે. જેની વિસ્તૃત પત્રિકા બહાર પાડવામાં આવેલ છે જે વાંચી સમજી વર્તવું.

પરમપૂજય સદ્ગુરુશ્રી વલ્લભરામ સંવત્સરી ઉત્સવ (અનાવલ)

આપણા સર્વજ્ઞા, સર્વશક્તિમાન અને પરમ હિતકારી સદ્ગુરુશ્રી વલ્લભરામ મહારાજની મોક્ષગમન તિથિ સંવત ૨૦૭૧ના ચૈત્ર વદ બારસને તા. ૧૬-૦૪-૨૦૧૫ના રોજ હોવાથી તા. ૧૫-૦૪-૨૦૧૫ અને તા. ૧૬-૦૪-૨૦૧૫ એમ બે દિવસ માટે આ સંવત્સરી ઉત્સવ વલ્લભાશ્રમ, અનાવલ મધ્યે આનંદપૂર્વક ઉજવવામાં આવશે. જેથી આ ઉત્સવમાં ભાગ લેવા તમામ મુમુક્ષુઓએ તા. ૧૪-૦૪-૨૦૧૫ને મંગાળવારની સાંજ સુધીમાં વલ્લભાશ્રમ આવી જવું.

છુટક નકલ રૂ. ૫૦૦
વાર્ષિક લવાજમ રૂ. ૬૦૦૦

Chetavni (GUJ) RNI No. GUJ GUJ / 2005 / 16095
Postal Regd. No. GAMC-1507/2015-2017 Valid up 31-Dec-2017
Posted at Ah'd PSO On 27th of Every Month



“પરમખ્રાનંદનો અનુભવ કોઈ પણ દ્રષ્ટ વડે
જોવાતો નથી, કોઈપણ કર્ણ વડે સંભળાતો નથી,
કોઈપણ મન બુદ્ધિ કે અંતરથી કલ્પી શકાતો નથી, પણ
માત્ર અનુભવાય જ છે. અર્થાત્ જોયા વિના, કલ્પ્યા
વિના અને જોવાનો ભાવ રાખ્યા વિના જે જણાય તે જ
અલોકિક ખ્રાનંદ છે અને તે ખ્રાસાનો અનુભવ માત્ર
આત્મચેતનાને થતો હોવાથી કોઈ છેહો, મન-બુદ્ધિ કે
અંતર તેને જાણી શકતાં નથી. કેમ કે માયા (૪૮) ના
અનુભવનું જ્ઞાન ચૈતાંબ્યને થઈ શકે છે. પણ ચૈતાંબ્યના
અનુભવનું જ્ઞાન માયાવાળા લૌકિક (૪૮) ને થઈ શકતું
નથી.”

વર્ષ-૧૧, અંક-૨, સંવત ૨૦૭૧ ફાગણ સુદ-૮, શુક્રવાર ૨૭-૦૨-૨૦૧૫

માલિક, મુદ્રક/પ્રકાશક અને તંત્રી	: જ્યવર્ધન રમુજીલાલ વ્યાસ વલ્લભવાડી રામબાગ, મણીનગર, અમદાવાદ-૩૮૦૦૦૮. દ્વારાતા. ૨૭-૦૨-૨૦૧૫ના રોજ પ્રસિધ્ય કર્યું.
ચેતવણી કાર્યાલય	: વલ્લભવાડી, રામબાગ, મણીનગર, અમદાવાદ-૩૮૦૦૦૮.
મુદ્રણ સ્થળ	: ભવાની ઓફિસેટ, ૩/૨૦, કેલાસ એસ્ટેટ, ઓઢવ, અમદાવાદ-૩૮૨૪૧૫.